



HN-001-017304 Seat No. _____

M. A. (Sem. III) (CBCS) Examination

May/June - 2017

Psychology : Paper - ECT-5

(Behaviour Modification) (Old Course)

Faculty Code : 001

Subject Code : 017304

Time : 2½ Hours]

[Total Marks : 70

સૂચના : (૧) બધા પ્રશ્નો ફરજિયાત છે.
(૨) બધા પ્રશ્નોના ગુણ સરખા છે.

૧ વર્તન ફેરફાર એટલે શું ? વર્તન ફેરફારના પાયાના આધારસ્તંભ કયા કયા છે ૧૪
તે સવિસ્તર સમજાવો.

અથવા

૧ પરંપરાગત મૂલ્યાંકન અને વાર્તાનિક મૂલ્યાંકન વચ્ચેનો તફાવત વિગતે સમજાવો. ૧૪

૨ કમબદ્ધ અસંવેદનીકરણ ચર્ચો. ૧૪

અથવા

૨ આગ્રહીપણું (Assertiveness) અને તેની તાલીમ ચર્ચો. ૧૪

૩ મોડેલિંગ અને વાર્તાનિક પૂર્વતાલીમ ચર્ચો. ૧૪

અથવા

૩ પ્રબલન એટલે શું ? પ્રબલનના ઉપક્રમો ચર્ચો. ૧૪

૪ સંભાવ્ય સ્થિતિઓના પ્રબંધની ચર્ચા કરો. ૧૪

અથવા

૪ નવાં વર્તનોનું આકાર-ઘડતર અને શૃંખલાબદ્ધતા કેવી રીતે કરી શકાય ? ચર્ચો. ૧૪

- ૫ નીચેનામાંથી કોઈ પણ બે નોંધ લખો : ૧૪
- (૧) ટોકન ઇકોનોમી
(૨) રીલેક્સેશન પ્રક્રિયા
(૩) યોગ
(૪) ધ્યાન.

ENGLISH VERSION

- Instructions :** (1) All questions are compulsory.
(2) All questions carry equal marks.

- 1 Behaviour Modification means what ? Explain the foundation of Behaviour Modification. 14
- OR
- 1 Explain in detail the difference between Traditional Assessment and Behavioural Assessment. 14
- 2 Discuss Systematic Desensitization. 14
- OR
- 2 Discuss Assertiveness training. 14
- 3 Discuss Modeling and Behaviour Rehearsal Procedures. 14
- OR
- 3 What is Reinforcement ? Discuss schedules of Reinforcement. 14
- 4 Discuss Contingency Management. 14
- OR
- 4 Discuss how shaping and chaining New Behaviour can be done. 14
- 5 Write any two notes : 14
- (1) Token Economy
(2) Relaxation Procedure
(3) Yoga
(4) Meditation.